

Essen Speciality Films Limited

Formerly known as **Essen Speciality Films Private Limited**

Regd. Office
Survey No. 192, Plot No. A,
Industrial Area, Behind Orchev Pharma,
Veraval (Shapar), Rajkot - 360 024
Gujarat - India

Phone : +91 98253 12701
E-mail : info@essenspeciality.com
Website : www.essenspeciality.com
CIN : L24224GJ2002PLC041119
GSTIN : 24AABCE2983N1ZC

ESSEN[®]
SPECIALITY FILMS LTD

January 25, 2025

To,
National Stock Exchange of India Limited
The Listing Department
Exchange Plaza, C-1, Block - G,
Bandra-Kurla Complex,
Bandra (East), Mumbai - 400 051

NSE Symbol: ESFL

Subject: Submission of Newspaper clippings of Extracts of Financial Results for the quarter and nine-months ended December 31, 2024

Reference: Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations")

Dear Sir/ Madam,

With reference to the captioned subject and pursuant to Regulation 47(1) of SEBI Listing Regulations, please find enclosed copy of newspaper clippings of Extracts of Unaudited Standalone Financial Results for the quarter and nine-months ended December 31, 2024 which has been published today i.e. Saturday, January 25, 2025 in following newspapers:

1. **"Economic Times"** - English Language Daily
2. **"Navgujarat Samay"** - Gujarati Language Daily

Copy of newspaper clippings shall also be available on the website of the Company at <https://www.essenspeciality.com/investorszone.html>

We request you to kindly take the above information on record.

Thanking You.

Yours Faithfully,

For, **ESSEN SPECIALITY FILMS LIMITED**

Pallav K. Doshi
Chairman and Whole-time Director
DIN: 02542047

Encl: a/a

'Make New Voice-only Plans Cheaper'

After Trai call, Airtel cuts prices by another 6%, other players may follow suit; move could hurt telcos' revenues

Kiran Rathore
 The financial impact on telcos would depend on the volume of consumers availing the new offerings. Experts believe that since there would now be substantial price difference between bundled and voice-only plans, there could be sufficient demand for no-frills subscriptions.

Queries sent to Bharti Airtel, Reliance Jio and Vodafone Idea—the three private telcos—remained unanswered until the publication of this report. Analysts had earlier said they expected only a marginal impact as the price differential between bundled offerings and voice-only plans was very low. But with the revised cuts, the voice-only plans might prove attractive even for consumers using limited data resources. The move is also going to impact the ongoing migration of 2G users to 4G and 5G, potentially denting the plans of tel-

Answering a Call

EXPERTS SAY: All telcos' voice-only plans were only around 2% cheaper to bundled offerings. Big price difference between bundled plans and voice-only plans to make zero-data plan more attractive

Revised cuts could make voice-only plans more appealing to even low-data consuming users

Move may impact migration of 2G users to 4G and 5G

Likely impact seen on telcos' plans to raise average revenue per user

com firms to raise the average revenue per user (ARPU). When a 2G user migrates to 4G, there is 1.6x to 2x jump in ARPU, say market watchers.

The three private telcos have been rapidly migrating 2G users to 4G to boost revenues. But experts believe the latest Trai mandate of voice- and SMS-only packs is slated to slow down the upgrade process a bit, and impact ARPU growth.

All the telcos have announced their

owners and the elderly, living in rural areas, who don't want to buy current bundled offerings.

Airtel has launched two revised plans—for ₹1,849 which comes with 365 days validity and ₹469 for 84 days. Both offer unlimited calls. Airtel has earlier launched ₹1,959 and ₹599 plans with the same sets of benefits. Jio has launched plans for ₹1,958 with 365-day validity and ₹458 for 84-day validity.

The regulator believes that mandating voice- and SMS-only plans would provide an option to subscribers who do not require data. Earlier, the telcos companies had told Trai that the current bundled tariff plans have been designed to cater to the needs of all shades of users, which is why there was no need to introduce voice-or-SMS-only packs.

The companies had told Trai that data had become the central element in modern communication.

TARIFF HIKE IMPACT Telcos Lose More Active Users in Nov but Boost Data Base

Ashutosh Kumar
 jumped sharply in November, primarily led by Jio, suggesting greater acceptance for higher tariffs among data subscribers." Jeffrey said in a report, analyzing latest industry data collected by the Telecom Regulatory Authority of India (Trai).
 It added that Jio led data subscriber additions in November, gaining market share after cumulatively losing around 17 million subscribers since raising tariffs, which should make it more amenable to further tariff hikes.
 "We continue to expect Bharti and Jio to gain market share in the near term," the brokerage said.

CO MAY TAKE A CALL ON DIVIDEND THIS FISCAL END

'Indus to Form Unit for EV Infra; Tower Biz to Remain Key Driver'

Suhrojit Mallick

New Delhi: Indus Towers will form a separate unit for building the necessary charging infrastructure for electric vehicles, while its tower business will remain its primary driver, a top company executive said. Mumbai-listed Indus Towers, one among the world's largest telecom tower companies, also said it will take a call by the end of this fiscal year on disbursing dividends to shareholders, amidst strong cash flows following a significant receipt of past overdues from Vodafone Idea. "We will maintain the difference so that the tower business does not suffer. A separate business unit is going to drive the business," said Prachar Sah, chief executive, Indus Towers during an earnings call on Friday.
 Although at an early stage, Indus expects mid-to-high double-digit returns in the EV business, Sah said. Indus announced on Thursday that it will leverage its expertise in managing and providing space,

power, and operations and maintenance to set up EV charging stations, to supplement its tower business. Sah added that Indus' selection of contracts and deals that it will make with customers will be prudent in terms of making sure it is close to the business model of its tower business. "It is something that will be new to the industry as well. So we will be very cautious on that," Sah said. The company has launched pilot EV charging stations in Gurugram and Bengaluru. Indus reported a nearly three-fold jump in net profit at ₹1,003 crore in Q3 FY25 on the back of strong tower additions and significant collections of overdues from Vodafone Idea.
 "The tower company on Friday said it already has a dominant market share in Vodafone Idea's ongoing network expansion, amidst slowing pace of 5G rollout from Bharti Airtel, its other key customer.
 "The resumption of the network expansion by a major customer (read Vodafone Idea) bodes well for us. We believe that we are well placed to capture a meaningful share of its tenancy additions in the coming quarters as well," Sah said.
 Indus said the industry has deployed almost 465,000 5G base stations, with over 50,000 base stations deployed in 2024, indicating that the pace of deployment has slowed down.
 "5G loading contributes meaningfully to the overall loading revenue. We expect that 5G loading revenues to be gradually supplemented by a demand for new sites once a certain penetration level is achieved to aid the network condition," the company said.



Lower 5G Spends by Top Indian Telcos Dent Ericsson's Sales in Q4

Our Bureau

New Delhi: Swedish telecom gear maker Ericsson on Friday reported a 28% year-on-year fall in sales to 8.4 billion crowns (₹6,836 crore) in the Southeast Asia, Oceania and India region in the fourth quarter of 2024 as top Indian telecom carriers Reliance Jio and Bharti Airtel scaled back their 5G investments. Ericsson, which follows the January-December financial year, had reported sales of 11.8 billion crowns a year earlier.
 "Network sales declined primarily due to lower customer investment levels in India after a record 2023," Ericsson said in its earnings report, adding that it won a multi-year contract extension for 4G and 5G radio access network (RAN) with Bharti Airtel in India and the majority share of nationwide 5G deployment for telecom company VNTN in Vietnam.
 For the full year, Ericsson's sales in Southeast Asia, Oceania and India declined 38% year-on-year, reflecting normalised network investment levels in India after a record year in 2023.
 In the mobile network segment, sales in North America increased 70% year-on-year, benefitting from deal wins and increased network investments by large US carriers. By contrast, Ericsson said, sales in other markets decreased materially, particularly in Southeast Asia, Oceania and India.

3.8 GRAMS

TITANIUM

STEPPER EYEWEAR

The Perfect Fit

Available at all optical stores nationwide.

FOR TRADE ENQUIRIES EMAIL: info@stepperindia.com

Essen Speciality Films Limited

(Formerly known as Essen Speciality Films Private Limited)

Regd. Office : Survey No. 192, Plot No. A, Industrial Area, Behind Orchev Pharma, Veraval (Shapar), Rajkot, Gujarat - 360024, India
 Contact : +91 98253 12701 | Email : complainers@essenspeciality.com
 Website : www.essenspeciality.com | CIN : L24224GJ2002PC041119

EXTRACTS OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE-MONTHS ENDED DECEMBER 31, 2024

(Rs. in Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter Ended		
		31.12.2024	31.12.2024	31.12.2023
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	
1	Total income from operations	4,744.40	12,829.76	3,793.00
2	Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional and/ or Extraordinary Items#)	1,028.29	2,044.93	591.79
3	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/ or Extraordinary Items#)	1,028.29	2,044.93	591.79
4	Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/ or Extraordinary Items#)	747.23	1,532.21	455.88
5	Total Comprehensive Income for the period (Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	747.23	1,532.21	455.88
6	Equity Share Capital	2,483.90	2,483.90	2,069.92
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year			
8	Earnings Per Share (Face Value of Rs.10/- each)			
	Basic	3.01	6.17	1.84
	Diluted	3.01	6.17	1.84

There were no Exceptional and/ or Extraordinary items during the Quarter and Nine-months ended December 31, 2024.

Notes

- The Unaudited Financial Results for the quarter and nine-months ended December 31, 2024 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on January 24, 2025. The statutory auditors of the Company have carried out limited review of the above unaudited financial results and have issued an unqualified limited review report.
- These financial results have been prepared in accordance with the applicable with Accounting Standard ("AS") as prescribed under Section 133 of the Companies Act, 2013 read with Rule 7 of the Companies (Accounts) Rules, 2014.
- The above is an extract of the detailed format of financial results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results is available on the websites of the National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of the Company at https://www.essenspeciality.com/investorszone.html.

Scan QR Code to view complete Financial Results

Veraval (Shapar) on January 24, 2025

Sd/-
 Pailav K Doshi
 Chairman & Wholetime Director
 DIN: 02542047

Karnataka Soaps & Detergents Limited

(A Government of Karnataka Undertaking)

Sandal City, P.B No. 5531, Bengaluru - Pune Highway, Bengaluru - 560055. Ph: 080-22164879, 22164886,
 Website: www.mysorensandal.org E-mail: ksd.dgmtns@gmail.com

An ISO-9001:2015 & 14001:2015 Company

Date : 24.01.2025

NOTICE INVITING TENDER

Tenders are invited by KS&DL in two cover system through Karnataka Public Procurement Portal (Website: https://kppp.karnataka.gov.in/) with respect to supply of following Goods/Services/Works.

Sl. No.	Tender Number	Tender Name	Tender Quantity	Published date	last date of submission
1	KSDL/2024-25/IND0622	Procurement of Iso Menthone	2950 Kgs	21-01-2025	04-02-2025
2	KSDL/2024-25/IND0623	Procurement of Mentha Citrala Oil	14100 Kgs	21-01-2025	04-02-2025
3	KSDL/2024-25/IND0624	Procurement of Orange Oil	14810 Kgs	21-01-2025	04-02-2025
4	KSDL/2024-25/IND0625	Procurement of Pheryl Acetic Acid (Parfumery Grade)	19100 Kgs	21-01-2025	04-02-2025
5	KSDL/2024-25/IND0626	Procurement of Palmarosa oil	3600 Kgs	21-01-2025	04-02-2025
6	KSDL/2024-25/IND0627	Procurement of Para Ter-Butyl Cyclo Hexyl Acetate (PTBCHA)	55600 Kgs	21-01-2025	04-02-2025
7	KSDL/2024-25/IND0628	Procurement of Velvione	150 Kgs	21-01-2025	04-02-2025
8	KSDL/2024-25/IND0629	Procurement of Basil oil	140 Kgs	21-01-2025	04-02-2025
9	KSDL/2024-25/IND0630	Procurement of Citronellyl Nitrite	2330 Kgs	21-01-2025	04-02-2025
10	KSDL/2024-25/IND0631	Procurement of Di Propylene Glycol (DPG)	9550 Kgs	21-01-2025	04-02-2025
11	KSDL/2024-25/IND0632	Procurement of Geranyl Tiglate	600 Kgs	21-01-2025	04-02-2025
12	KSDL/2024-25/IND0633	Procurement of Hexanoyl-D	1350 Kgs	21-01-2025	04-02-2025
13	KSDL/2024-25/IND0634	Procurement of Acetoxyl pentyl tetra hydro pyran jasmony	50 Kgs	21-01-2025	04-02-2025
14	KSDL/2024-25/IND0635	Procurement of Lemongrass oil	560 Kgs	21-01-2025	04-02-2025
15	KSDL/2024-25/IND0636	Procurement of Linalyl Acetate	2570 Kgs	21-01-2025	04-02-2025
16	KSDL/2024-25/IND0637	Procurement of Methyl dihydro jasmonate (MDHJ)	500 Kgs	21-01-2025	04-02-2025
17	KSDL/2024-25/IND0638	Procurement of Methyl anthranilate	650 Kgs	21-01-2025	04-02-2025
18	KSDL/2024-25/IND0639	Procurement of Methyl Cinnamate	840 Kgs	21-01-2025	04-02-2025
19	KSDL/2024-25/IND0640	Procurement of Nerol	1770 Kgs	21-01-2025	04-02-2025
20	KSDL/2024-25/IND0641	Procurement of Para Cresyl Phenyl Acetate	530 Kgs	21-01-2025	04-02-2025
21	KSDL/2024-25/IND0641	Procurement of Medicines	Goods	21-01-2025	10-02-2025
22	KSDL/2024-25/IND0655	Procurement of Emulsifier	34358 Kgs	22-01-2025	10-02-2025
23	KSDL/2024-25/IND0656	Procurement of Dolomite Powder (Rajasthan source)	721 MT	22-01-2025	10-02-2025
24	KSDL/2024-25/IND0643	Procurement of maintenance work items for Detergent division	Goods	22-01-2025	07-02-2025
25	KSDL/2024-25/IND0658	Procurement of Dolomite Powder (Local)	721 MT	22-01-2025	10-02-2025
26	KSDL/2024-25/IND0667	Procurement of Cos. Grade - 800 mesh talc	41 MT	23-01-2025	10-02-2025
27	KSDL/2024-25/IND0668	Procurement of Arrow Klean P (L)	596 Kgs	23-01-2025	10-02-2025
28	KSDL/2024-25/IND0669	Procurement of Zinc Stearate	3429Kgs	23-01-2025	10-02-2025
29	KSDL/2024-25/IND0670	Procurement of Aloe Vera Juice	1673 Kgs	23-01-2025	10-02-2025
30	KSDL/2024-25/IND0671	Procurement of Amyris oil	1500 Kgs	23-01-2025	31-01-2025
31	KSDL/2024-25/IND0672	Procurement of Patchouli oil	2500 Kgs	23-01-2025	31-01-2025
32	KSDL/2024-25/IND0673	Procurement of Ambretteolide	500 Kgs	23-01-2025	31-01-2025
33	KSDL/2024-25/IND0674	Procurement of DFA Soap Noodles	5000 MT	23-01-2025	31-01-2025
34	KSDL/2024-25/IND0659	Procurement of Resinoid Labdanum	24000 Kgs	23-01-2025	06-02-2025
35	KSDL/2024-25/IND0660	Procurement of Pine oil	34800 Kgs	23-01-2025	06-02-2025
36	KSDL/2024-25/IND0661	Procurement of Lavandin oil	340 Kgs	23-01-2025	06-02-2025
37	KSDL/2024-25/IND0662	Procurement of Phenyl Ethyl Acetate	1000 Kgs	23-01-2025	06-02-2025
38	KSDL/2024-25/IND0663	Procurement of Resinoid oakmoss	340 Kgs	23-01-2025	06-02-2025
39	KSDL/2024-25/IND0664	Procurement of Timberal	180 Kgs	23-01-2025	06-02-2025
40	KSDL/2024-25/IND0665	Procurement of Vanillin	1000 Kgs	23-01-2025	06-02-2025
41	KSDL/2024-25/IND0666	Procurement of Yara Yara	3520 Kgs	23-01-2025	06-02-2025

For any queries contact the undersigned

Sd/- Asst. Gen. Manager (Materials)

